



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૫/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૫૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૭ કેસ કરી, ૩૩ વ્યક્તિઓને ઝડપી, ૩૪૧ લીટર દેશી દારૂ, ૨ બોટલ ઈંગ્લીશ દારૂ, અને ૧૧ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૬ કેસ કરી ૧૯ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૬૧,૫૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૫૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૭૬૦/૧૯

વસ્ત્રાપુર: નિશીતકુમાર કમલેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.૨૫) (રહે. અનોલી કોમ્પ્લેક્સ હોટલ લેક પેલેસ ઉપર સનરાઇઝ પાર્ક રોડ વસ્ત્રાપુર) એ તા.૦૧/૦૫/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૧/૧૯ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી રોહીત રમેશકુમાર બંસલ (રહે.ગોનીયા રોડ સીયારામ મંદીર ભટીદા પંજાબ) એ નિશીતકુમારનો વિશ્વાસ કેળવી બેન્કના ખાતા નંબર મેળવી ઓન લાઈન અલગ અલગ કંપનીમાંથી રૂપિયા ૨,૪૬,૦૦૦/- મેળવી લીધા હતા. ત્યાર બાદ એસ.બી.આઈ.નુ કેડીટ કાર્ડ કઢાવી રૂપિયા ૪૧,૦૦૦/- વાપરી કુલ રૂપિયા ૨,૮૭,૦૦૦/- વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.એલ.રબારી ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૭૬૧/૧૯

સોલા હાઈકોર્ટ: મહેશભાઈ કાલીચરણ શાહ (રહે. તક્ષશિલા એપાર્ટમેન્ટ બાગબાન પાર્ટીપ્લોટ પાસે થલતેઝ) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૪/૧૯ રાતના ૮/૦૦ થી તા.૦૧/૦૫/૧૯ સવારના ૯/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન ગોતા તળાવ સામે ઉમીયા એસ્ટેટ સામે શ્રી સીધ્ધી વિનાયક એજન્સી નામની હાર્ડવેર અને બાથફીટીંગની પતરાની દુકાન તથા ગોડાઉનના પતરા તેમજ જીપ્સમની સીલીંગ તોડી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ એલ.ઈ.ડી., સી.સી.ટી.વી.ડી.વી.આર, લીનોવા કંપનીનું લેપટોપ, ડિસ્પેલેની ચકલીઓના બોક્સ અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨,૩૬,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.ડી.પટેલ ચલાવે છે.

નરોડા: વિરેન્દ્ર સ/ઓ રમેશભાઈ પાઠર (રહે. ધનુષધારી સોસાયટી સૈજપુર બોધા નરોડા રોડ નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૪/૧૯ રાતના ૮/૦૦ થી તા.૦૧/૦૫/૧૯ કલાક ૧૦/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન નાના ચિલોડા દેવ આર્કેડ સામે કૈલાશ બંગલોઝ પાછળ કૈલાશ રીજોઇશ ફ્લેટની સાઇટની અંદર એ બ્લોક અને બી બ્લોકના ડકમાંથી અજાણી વ્યક્તિ કોપરના ઇલેક્ટ્રીક વાયર કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.કે.મોરી ચલાવે છે.

લુંટ:-

સમાચાર યાદી નં.૭૬૨/૧૯

વસ્ત્રાપુર: ઉર્મીલાબહેન વા/ઓ હર્ષદભાઈ શાહ (ઉ.વ.૬૯) (રહે.કિશાંત રેસીડન્સી આમ્રપાલી-૧ સામે બોદકદેવ) તા.૦૧/૦૫/૧૯ સાજના ૫/૩૦ વાગ્યાના સુમારે દિગમ્બર જૈન દેરાસરની આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ઉર્મીલાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેચી તોડી લુંટ કરી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ઉર્મીલાબહેન શાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જી.આર.ભરવાડ ચલાવે છે.

શહેરકોટડા: ભાવનાબહેન વા/ઓફ નટવરભારથી ગોસ્વામી (ઉ.વ.૫૦) (રહે. સીતાબા રો હાઉસ અંબિકા સ્કુલની બાજુમાં જોગીપુરા વાસ સૈજપુર ટાવરની અંદર સૈજપુર) તા.૩૦/૦૪/૧૯ રાતના ૧૧/૦૦ વાગ્યાના સુમારે અમદુપુરા ચામુંડા બ્રીજ નીચે દરગાહ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ભાવનાબહેનના ગળામાંથી સોના ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લુંટ કરી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ભાવનાબહેન ગોસ્વામીએ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.ડી.ચાવડા ચલાવે છે.

નિકોલ: જીતેન્દ્રભાઈ પરષોતમદાસ મીરાણી (રહે. રાજહંસ ફ્લેટ વી.આઇ.પી.સ્કૂલની બાજુમાં ડીમાઈ પાછળ ન્યુ ઇન્ડિયા કોલોની નિકોલ) તા.૩૦/૦૪/૧૯ રાતના ૧૦/૩૦ વાગ્યાના સુમારે મધુવન પાર્ટી પ્લોટ ચાર રસ્તા થી ડી માઈ જવાના રોડની વચ્ચે આવેલ સાઇ હેવન ફ્લેટ સામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ જીતેન્દ્રભાઈના ગળામાંથી સોના ચેઈન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેચી તોડી લુંટ કરી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ જીતેન્દ્રભાઈ મીરાણીએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.જે.સથવારા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૭૬૩/૧૯

સરખેજ: ઉમેન્દ્રસિંહ સ/ઓફ મુત્યજયસિંહ (ઉ.વ.૨૫) (રહે. દેવ એઝોટીકા ધુમા બોપલ) એ તા.૨૬/૦૪/૧૯ કલાક ૬/૪૫ વાગે સરખેજ એચ.ડી.એફ.સી.બેંક આંબલીની સામે બોપલ બ્રીજ (વકીલ બ્રીજ) નીચે પોતાનું કે.ટી.એમ.મોટર સાયકલ નંબર જીજે ૨૭ સીઆર ૦૨૧૯ કિંમત રૂપિયા ૧,૧૨,૦૦૦/- પાર્ક કર્યું હતું. જેની ચોરી સાજના ૫/૧૫ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ ઉમેન્દ્રસિંહ એ તા.૦૧/૦૫/૧૯ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પ્રો.વુ.પો.સ.ઈ.શ્રી એન.પી.સોનારા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.